CEEJAY FINANCE LIMITED

9th Floor, Abhijit-II, Mithakhali Six Road, Ellisbridge, Ahmedabad-380 006. Phone : (079) 40050927 (079) 26404594 26404689 Fax : (079) 26424457



Date: 17th August, 2022

To, **The Manager (Listing), The BSE Limited** 25th Floor, P. J. Towers, Dalal Street Fort, Mumbai – 400 001

Scrip Code: 530789

Sub: Intimation under Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations, 2015") - Newspaper Advertisement

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith copies of the Notice published on 17th August, 2022 in Western Times (English) and Western Times (Gujarati) newspapers regarding intimation of Annual General Meeting, e-voting instructions and other information regarding Company's ensuing Annual General Meeting scheduled to be held on 24th September, 2022.

Kindly acknowledge the receipt and take the above on record.

Thanking You,

Yours Faithfully,

For Ceejay Finance Limited

will

Shailesh Bharvad Company Secretary & Compliance Officer

Encl: As above





Susses IOL Chemicals and Pharma. Reports Q1 FY23 Results Mumbai: IOL Chemicals new geographies and derisk the business with contisk the business with contisk the business with continuour backward integra

Mumbai: IOL Chemicals and Pharmaceuticals Limited, a leading manufacturer of pharmaceutical (APIs) and specialty chemicals reported results for the first quarter ended June 30, 2022.

Commenting on the performance of the Company during the quarter, Dr Sanjay Chaturvedi, Executive Director & CEO said, "Over the next few years, our focus will be on diversifying into other speciality chemical products and increase the share of non-Ibuprofen business. The investment planned in setting up a new plant will aid the Company in strengthening its position in both, Domestic and Export markets, thereby helping in improving our market share. Over the course of next few quarters, the Company's plan to explore

San Francisco, Aug 16

(IANS) Flexible office space

provider WeWork cofounder and former CEO

Adam Neumann has re-

ceived around \$350 million

funding from top investment fund Andreessen

Horowitz (a16z) for his upcoming new rental real es-

tate business, called Flow.

Flow's valuation at over \$1

billion (a unicorn status) and

the startup is yet to be

launched.

The investment puts

"We are excited to part-

tinuous backward integration model will play out leading to improvement in revenue as well as profitability." "Various business challénges of softening demand, rising inputs costs and volatility in chemical prices are slowly getting normalised as can be seen from recovery in EBITDA margins. However, we believe that the challenges are a temporary phenomenon. The robust global demand on specialty chemicals fronts owing to shift in market share from China would benefit the sector over next few years", Dr Chaturvedi said. Ás one of largest manufacturers of Ethyl Acetate, Company the

WeWork co-founder's startup gets

unicorn status even before launch

end of current fiscal. The investment of Rs 15 Crore for this capex is being funded through internal accruals only. Ethyl Acetate is widely used in Printing & Packing Industry, Adhesives, Agrochemicals & Pesticides industry, pharmaceuticals industry and cosmetics industry. The Company will also be making further in-roads into western markets of India through a new plant for specialty chemicals and pharmaceuticals intermediates. This project, which is expected to be completed in 18 months, will require

few years", Dr Chaturvedi said.As one of largest manufacturers of Ethyl Acetate, the Company will strengthen its position in the 'green solvent' market by increasing its capacity by

'There will be blood on streets,' Google execs warn employees about layoffs

San Francisco, Aug 16 (IANS) As Big Tech companies begin to lay off employees in the global economic downturn, Google executives have reportedly warned workers to either boost performance or prepare to leave as "there will be blood on the streets" if the next quarterly earnings are not good.

In a company message viewed by Insider, Google Cloud sales leadership has threatened employees with an "overall examination of sales productivity and productivity in general" and that if next quarter results "don't look up, there will be blood on the streets."

If third quarter results "don't look up, [then] there will be blood on the streets," according to a message conveyed to the sales team. The warning was first reported by Insider. Google employees are "fearful of layoffs" after the company quietly extended its hiring freeze this month without making an announcement, reports The New York Post.

The company has now reportedly warned employees with layoffs if they don't produce results. Alphabet and Google

CEO Sundar Pichai told employees late last month that they must improve productivity due to fierce economic headwinds.

Pichai said that he wanted to solicit ideas from his employees on how to get "better results faster"

get "better results faster."
"There are real concerns that our productivity as a whole is not where it needs to be for the head count we have,"
he was quoted as saying.
Google in July put a freeze on hiring for two weeks to review its headcount needs and decide on future course of action. The company earlier announced to slow down hirings for the rest of the year. According to Pichai, "it's clear we are facing a challenging macro environment with more uncertainty ahead". Alphabet, the parent company of Google, reported weaker-than-expected earnings and revenue for the April-June period (Q2). Revenue growth slowed to 13 per cent from 62 per cent in the same quarter last year.

Business Brief

70 employees of HBO Max streaming service lose jobs

San Francisco, Aug 16 (IANS) Warner Bros Discovery (WBD) has laid off nearly 70 workers, or 14 per cent of its workforce, at HBO and HBO Max streaming service. The staff is being fired under HBO and HBO Max chief content officer Casey Bloys, impacting 70 employees, reports The New York Times. "Unscripted and live-action family programming for HBO Max, the streaming service, were most affected," the report said late on Monday. Other cuts impacted HBO Max's casting, acquisitions and international departments. The latest round of layoffs come after AT&T's WarnerMedia officially merged with Discovery, Inc. in April. The deal saw AT&T receive \$43 billion in a combination of cash debt securities and debt retention.

LIPPI SYSTEMS LTD.

Reg.Off: 3rd Floor, Satya Complex,Opp.IOC Petrol Pump, Nr.Ashwamegh IV, 132 ft Ring Road,Satellite,Ahmedabad-380015 Ph.No.079-26750060 / 26750061, Email Id:-cs@lippisystems.com,officelippi@gmail.com web site :-www.lippisystems.com CIN :- L22100GJ1993PLC020382 Unaudited Standalone Financial Results For The Quarter Ended On June 30, 2022

				(R	s. In Lacs
<u>.</u>		Quarter ended			Year ende
Sr. No.	Particulars	June 30,2022	March 31, 2022	June 30, 2021	March 31, 2022
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited
1	Total Income From Operations	40.10	533.77	304.67	1,455.68
2	Profit /(loss) before exceptional items and tax	(28.15)	182.50	10.30	119.36
3	Profit / (loss) before tax				
	(after Execption and/or Extraordinary items)	(28.15)	182.50	10.30	119.36
4	Profit / (loss) for the period after tax				
	(after Execption and/or Extraordinary items)	(21.05)	140.91	7.43	83.78
5	Other Comprehensive income (OCI)	0.28	(7.82)	0.96	(15.62
6	Total Comprehensive Income for the period (7+8)	(20.76)	133.09	8.39	68.16
7	Paid - up equity share capital (face value of share :				
	Rs 10 each)	700.00	700.00	700.00	700.00
8	Earnings per share (EPS) of Rs 10 each (Not annualised):				
	(a) Basic EPS (Rs.)	(0.30)	2.01	0.11	1.20
	(b) Diluted EPS (Rs.)	(0.30)	2.01	0.11	1.20

NOTES:

- Investor can view the unaudited financial results of the company for the quarter ended 30th June, 2022 on company's website: www.lippisystems.com or on the website of the BSE www.bseindia.com.
- Figures of the previous period have been re-grouped /re-arranged wherever necessary.

 By Order Of The Board

 Nandlal J.Agrawal

 Place : Ahmedabad
 (Managing Director)

 Date : 14/08/2022
 (DIN :- 00336556)

E AUCTION NOTICE FIRE AFFECTED APPROX. 8,600 KG OF SCRAP ITEMS FROM ELECTRICAL PANEL

Interested Buyers are invited to participate in the e-Auction for the disposal of "Fire Affected Approx. 8,600 Kg Of Scrap Items From Electrical Panel" on "Per Kg" Basis. The subject salvage will be sold on "As is Where is", Whatever there is" and "No Complaint" Basis and belongs to **M/s. Pratibha Fabrics Ltd.** The subject materials can be inspected at GIDC Industrial estate, Pandesra, Surat, Gujarat between **17-08-22** to **25-08-22** between **11 AM to 4 PM** on working days only. Kindly contact **Mr. Anand Singh at 9924522268** for inspection.

E-Auction will be held on 26-08-22 @ 04.00 P.M. Kindly contact Mr. Shamsher Singh at 9702985122 to obtain the form containing terms & conditions of e-Auction or download from website https://www.sealthedeal.co.in/. Auctioneers: Seal The Deal having registered office at Shop No. 148, Pocket C2 Sector 5. Bohini. Delhi - 110085

ner with Adam Neumann and his colleagues on Flow. Adam is a visionary leader who revolutionised the second largest asset class in the world -- commercial real estate -- by bringing community and brand to an industry in which neither existed before," Marc Andreessen said in a blogpost late on Monday.

late on Monday. "We think it is natural that for his first venture since WeWork, Adam returns to the theme of connecting people through transforming their physical spaces and building communities where people spend the most time: their homes," he added. In May, a16z invested \$70 million into Neumann's Blockchain-based carbon credit platform called Flowcarbon."We understand how difficult it is to build something like this and we love seeing repeat-founders build on past successes by growing from lessons learned," Andreessen said.It's still now clear how Flow seeks to revolutionise the residential housing industry.

WESTERN RAILWAY-VADODARA DIVISION Open 'E' tender notice Outsourcing of maintenance of psi

Tender No. EL/TRD/Tender/22-23/01 Tenders for and on behalf of The President of India are invited by Divisional Railway, Manager (Electrical Tr.D) Western Railway, Pratapnagar, Vadodara-390004 for the following works. Sr. No. 1 Tender No. & Name of Work: EL/TRD/Tender/22-23/01 Outsourcing of maintenance of the PSI (Power Supply Installation) assets and other Auxiliary activities in Surat - Geratpur, Vadodara - Godhra, Godhra - Anand & Anand - Khambhat sections of Vadodara

Addia Totambroximate costs of the work (in ₹) : 3,30,72,090/- Earnest Money to be deposited (in ₹): 3,15,400/- Cost of Tender document and completion period : Free of cost. Completion period 24 months. Tender scheduled on: Tender closing date 12.09,2022 and time of Closing at 15.00 hrs. on the same date. Web page particulars and notice for location where complete details can be seen & address of the office and clarification: Website @ www.ireps.gov.in Divisional Railway

Saturday 27-08-2022 between 10.00 a.m. to 12.00 p.m. This would contnue tll the aucton process is over. Amroli 0261-2495005 FEDGL01390002337, 0002338, 0002693 Anjar 02836-245100 FEDGL03480001386 0001916, 0001923 Ashram Road 9638747066 FEDGL03370001635, 0001954, 0001965 Balasinor 9409521023 FEDGL03590000593, 0000611, 0000622 Bapungar 079-22702881 FEDGL0367001713, 0001714 Bavla 02714-230483 FEDGL01300001906, 0001917, 0001921, 0001971, 0001973 Bhagwat Mansa 02763-273200 FEDGL03400000897, 0001202 Bhavnagar Waghawadi Road 02782560905/9033620379 FEDGL03890000831 0000834, 0001153, 0002041, 0001545 Botad 02849-252414 FEDGL01530003347, 0003349, 0003370, 0003371, 0003374, 0003376 DEESA 7016014308 FEDGL03410001036 Deodar 9638294929 FEDGL03420000483, 0000422 Gandhi Nagar Sector 16 079-23223380 FEDGL01540001497, 0001509, 0001730 Gandhidham Banking Circle Galiuli Nagai Sector 18 075-2525350 PEDGU354001137, 001130, 001130 Galiuliarian Banking Citte 9601502653 FEDGU3555001003, 0002403, 0001919 Himatagar 02772-24257 FEDGU3580000616 0000618, 0001580, 0001146 Hirabaugh 8530918709 FEDGL01110001765, 0001782 Kadi 02764-265501 FEDGL01330001433, 0001436, 0001463 Kalol 02764-225501 FEDGL01380002021, 0002034, 0002039, KODIASIO1250012500171, 0003205, 0003205, 0003241, 0002696 Kamrej 02621-251005 FEDGL01450002111, 0003108
KODINAR 9924730944 FEDGL0492000264, 0000033 Kuber Nagar 079-22801120 FEDGL01410002300, FEDBD01410000014 Limdi 02753-261200/ 270010 FEDGL03340001743, 0001751, 0001761, 0001768, 0002779, 0002493, 0002810 Mandvi 6353192505 FEDGL03490000453, 0000488, 0000490, 0000747, 0000748, 0001491 Maninagar 079-25463356 FEDGL00680001147 Mehsana 9426876308 FEDGL03570000509, 0000510, 0000713 Modasa 02774244244 / FEDGL03670000868, 0001103 Morbi 0282-2222622 FEDGL03320002111, 0002565 0002597 Palanpur 9601469914 FEDGL04760000548, 0000218 Parvat Pata 9824246967 FEDGL04530000311 Porbandar 2862240400 FEDGL03600001000, 0001046 Radhanpur 7016014308 FEDGL03430001153, 0001165, 0001180 Sadhu Vaswani Road 7359007981 FEDGL00780001953, 0002326, 0002330, 0003151, 0002530, 0003203, 0002128 SANAND 9725935505 FEDGL0491000209, 0000187, 000227, 000024 0000244, 0000123 SARTHANA 7567605055 FEDGL01050002345, 0002639 Surendranagar Wadhwan 02752-221333 FEDGL03310004289, 0002594, 0004290, 0003294, 0004327, 0004182 Udhna 0261-227700 EFDGL01490003129, 0003576, 0003603, 000458, 0004592 Valsad 968746174 FEDGL04540000764, 0000418 0000765, 0000796, 0000803 Vapi 0260-2427277 FEDGL04230000411, 0000886, 0000485, 0000891, 0000892 0000917, 0000934 Varachha 0261-2541005 FEDGL01460001510 Veraval 2876222662 FEDGL03660000899 0000934, 0000944, 0001346, 0002362, 0002171

Change in Venue or Date, if any will be displayed on our Website www.fedfna.com. All bidders partcipatng will be intmated subsequently with respect to acceptance or rejecton of bids submited by them. Customer who want to release their ornaments shall visit at the base branch wherein the ornaments were pledged by the customer or contact at the number mentoned above on/or before 26-08-2022 subject to the terms and conditon applicable.

Aucton will be conduct ed at respectve branches, in case the aucton does not get completed on the given date due to any reasons, the aucton in respect thereto shall be conducted on subsequent working days at district level branch afer displaying the details on our Website. No further communicaton shall be issued in this regard.
Dated : 17-08-2022 For, sdl- Authorised Signatory
Place : Guiarat Fedbank Financial Services Ltd.



NOTICE

1. NOTICE is hereby given that the 41st Annual General Meeting (AGM) of Gujarat Themis Biosyn Limited (the Company) will be held through Video Conferencing("VC")/Other Audio-Visual Means("OAVM") on 7th September, 2022 at 12:00 Noon, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with General Circulars No. 14/2020 dated April 08, 2020; No.17/2020 dated April 13, 2020 and No.20/2020 dated May 5, 2020;No. 02/2021 dated January 13, 2021, 21/2021 dated December 14, 2021 and 2/2022 dated May 5, 2022 and other applicable circulars issued by the Ministry of Corporate Affairs("MCA") and circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and Circulars No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 of SEBI (collectively referred to as "applicable circulars"), to transact the business set out in the Notice convening

CEEJAY FINANCE LIMITED



CIN: L65910GJ1993PLC019090, Regd. Office: C.J. House, Mota Pore, Nadiad-387001, Gujarat. Phone No: 0268-2562633, E-Mail:<u>shaileshbharvad@ceejayfinance.com,</u> Website: www.ceejayfinance.com

NOTICE OF 29TH ANNUAL GENERAL MEETING AND

E-VOTING INFORMATION

1.NOTICE is hereby given that pursuant to Rule 20 of the Companies (Management & Administration) Rules, 2014 the 29th Annual General Meeting ("AGM") of the Shareholders of the Company will be held through Video Conferencing ("VC")/Other Audio-Visual Means ("OAVM") on Saturday, 24th September, 2022 at 11.00 a.m. (IST), in compliance with General Circular No. 14/2020, 17/2020, 20/2020, 02/2021, 02/2022 issued in April, May, 2020, January, 2021 and May, 2022, and all other applicable laws and circulars issued by the Ministry of Corporate Affairs ("MCA"), Government of India and Securities and Exchange Board of India to transact the Business as contained in the Notice of the meeting.

2. In compliance with the above circulars, electronic copies of the Notice of the 29th AGM and Annual Report 2021-22 have been sent to all the shareholders on whose e-mail

FEDBANK FINANCIAL SERVICES LTD. AUCTION NOTICE This is to inform the public at large, that FEDBANK FINANCIAL SERVICES LTD., has decided to conduct Auctor

of Gold ornaments belonging to accounts (mentoned below) which have become overdue or which have defaults or margin breach customers. The Aucton would be held at respective Branches specified below on

Last date of Submission of form & EMD Demand Draft is 25-08-22 before 02.00 P.M.

f form Pratapnagar, Vadodara-390004. (EL/TRD/ Tender/22-23/01 dtd. 12.08.2022) 103 P.M. Like us on: f facebook.com/WesternRly

WESTERN RAILWAY STORES DEPARTMENT e- AUCTION SALE DURING SEPTEMBER, 2022 FOR P-WAY & OTHER VARIOUS SCRAP								
SPECIAL ATTENTION: ALL STEEL PURCHASERS & RE-ROLLERS								
Public e-auction for disposal of P. way scrap, rail scrap & other various scrap material will be held in SEPT,2022 as per program given below:-								
1 st ROUND	2 nd ROUND	DEPOT	DEPOT OFFICER IN CHARGE	CONTACT NO.				
05.09.22	16.09.22	RAJKOT	Sr. Divisional Materials Manager - Rajkot	02652641592/ 9724091750				
06.09.22	19.09.22	SABARMATI	Deputy Chief Materials Manager - Sabarmati	07927500080/ 09724093774				
07.09.22	20.09.22	VADODARA	Sr. Divisional Materials Manager - Vadodara	02652641592/ 9724091750				
12.09.22	21.09.22	RATLAM	Deputy Chief Materials Manager - Ratlam	07927500080/ 09724093774				
13.09.22	22.09.22	BHAVNAGAR	Sr. Divisional Materials Manager - Bhavnagar	02782444360/ 09724097750				
14.09.22	23.09.22	AHMEDABAD	Sr. Divisional Materials Manager - Ahmedabad	07922205888/ 09724093750				
15.09.22	26.09.22	DAHOD	Deputy Chief Materials Manager - Dahod	02673241295/ 09724090455				
15.09.22	27.09.22	MAHALAXMI	Deputy Chief Materials Manager - Mahalaxmi	022-24929571/ 09004495750				
16.09.22	28.09.22	PRATAP NAGAR	Sr. Divisional Materials Manager - Pratapnagar	02652641592/ 9724091750				
19.09.22	29.09.22	MUMBAI CENTRAL	Sr. Divisional Materials Manager - Mumbai Central	022-23094142/ 09004499006				

For detailed information please contact the concerned Depot/Divisional Officers. **Note: 1**. Railway reserves the right to withdraw any lot from e-Auction. **2**. e-Auction will start at as per scheduled time. **3**. e-Auction catalogues will be available on site <u>www.ireps.gov.in</u> e-Auction portal. **4**. In case of any assistance required regarding e-Auction, digital signatures, Registration procedure and participation, please contact above mentioned depot Officer. **5**. All payment transactions shall be done through the online payment gateway.

(No.SIII/Auction Programme-1 / SEPT-2022 Dated 12.08.2022) 0348 Like us on : 1 facebook.com/WesternRly follows us on : 2 twitter.com/WesternRly

PUBLIC NOTICE

This is to inform the public that our client Mr. Jani Dineshkumar Talkaram, domiciled at Jadiya, now residing at Res. No. 153/1 Plot No. 144 Deesa Dhanera highway, Ta.Dhanera, Dist.Banaskanthawala has requested Ioan from BANK OF BARODA on the property owned by him mentioned below. Property as per Revenue Survey No.153/1, Plot No.144, measuring 111.52 sq.mtrs and 1200 sq.ft.

The above mentioned property has been sold by our client Jani Dineshkumar Talkaram from Purohit Lerabhai Motiji vide Reg. Sale Document No. 440, dated 05/04/2013. It was previously held for sale by Mrs. Artiben W/O Samirbhai Panchal vide Reg. Sale Document No.1409, dated 05 /03/2008 by Sadar Property Purohit Lerabhai Motiji. It was previously held by Mrs. Artiben W/O Sameerbhai Panchal. Narangiben W/O Masrimal Mafatlal Soni held the sale vide Reg. Sale deed No.5960, dated 01/12/2006. Earlier Mr. Smt. Narangiben W/O Masrimal Mafatlal Soni sadar property of Smt. Modi Shardaben Ishwarlal Reg. sale Document No.3151, dated 27/06/2006 held the sale. It was earlier sold by Mrs. Modi Shardaben Ishwarlal Sadar Milkat Shankarlal Mulchand Khatri vide Reg. Sale Document No. 4117 dated 27/12/1991. Thus the previous sale document no. 1409, dt.05/03/2008 and Document No. 5960 dated 01/12/2006 have been lost somewhere along with the receipt of our client and have not been found till date despite many efforts. Also, our client has not taken any loan / credit from any bank or financial institution. Also,

Also, our client has not taken any loan / credit from any bank or financial institution. Also, there is no court proceedings or litigation pending or any kind of burden or debt of the government has not been registered on the above properties.

Any other person or bank, or any person or entity in any manner whatsoever has any right, interest, claim or interest, mortgage, encumbrance, lien, share right, inheritance right, rent right, sale right, or has taken or acquired the subject property. If there is any objection or dispute, inform us by registered AD on or before 7th. If this is not done, then we understand that we do not have any right, share, claim or share or interest in the subject property. We will issue. And will process the loan through BANK OF BARODA. After that, please note that there will be no objection or dispute.

 ADDRESS FOR PUBLICATION OF NOTICES AND OBJECTIONS

 Through Us,
 Bharatbhai K. Tank - Advocate

 Office: 19, Balaji Plaza, Below Bank of Baroda, Opposite Post Office
 Dhanera, Ta-Dhanera, Mo. No. 9727532506

 Place: Dhanera
 Office: Shop 2, 1st Floor Sankalp Complex, Beside Gayatri Mandir

 DATE-16/08/2022
 Highway Road Disa , Dist-Banaskantha. Mo.No. 9727532506

the AGM. Members will be able to attend and vote at the AGM through VC/OAVM. Members participating through the VC/OAVM facility only shall be deemed to be present at the AGM and their presence shall be reckoned for the purpose of guorum.

- In compliance with the applicable circulars, the Notice convening the AGM and the standalone financial statements for the financial year 2021-22, along with Board's Report, Auditors' Report and other documents required to be attached thereto, have been sent to all the Members of the Company only via electronic mode on **Tuesday**, **16th August**, **2022** whose email addresses are registered with Company/ Depository Participants(s). The aforesaid documents will also be available on the Company's website at www.gtbl.in and on the website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com.
- 3. Instructions for remote e-voting and e-voting during AGM
- a. The Company is providing to its members facility to exercise their right to vote on resolutions proposed to be passed at AGM by electronic means("e-voting").Members may cast their votes remotely, using the electronic voting system of CDSL during the period mentioned herein below ("remote e-voting").
- b. Further, the facility for voting through electronic voting system will also be made available at the AGM and members attending who have not cast their vote(s) by remote e-voting will be able to vote at the AGM through e-voting.
- c. The members who have cast their vote(s) by remote e-voting may also attend the AGM but shall not be entitled to cast their vote(s) again at the AGM.
- The Company has engaged the services of Central Depository Services (India) Limited (CDSL) an agency to provide ("remote e-voting").
- e. The Company has engaged the services of Company's RTA Link Intime India Private Limited as the Agency to provide for participation in the 41st AGM through VC/OAVM Facility (Instameet) and e-Voting during the 41st AGM.
- f. Information and instructions including details of user id and password relating to e-voting have been sent to members through e-mail.
- g. Members are requested to carefully read the instructions mentioned in the notes forming part of Notice of the 41st AGM for remote e-voting and for attending AGM and e- voting at AGM.

h.The remote e-voting facility will be available during the following period:Date and time of Commencement of remote e-votingSunday, August 4, 2022 at 9:00 amDate and time of end of remote e-voting.Tuesday, August 6, 2022 at 5:00 pm

- i. The remote e-voting module shall be disabled by CDSL for voting thereafter. Once the vote on resolution is cast by shareholder, the shareholder shall not be allowed to change it subsequently. Shareholders' of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date **Tuesday**, **August 30**, **2022** may cast their vote electronically.
- j. Any person, who acquires shares of the Company and becomes a member of the Company after dispatch of the Notice and holding shares as on the cut-off date i.e. Tuesday, 30th August 2022, may obtain the login ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.comor rnt.helpdesk@linkintime.co.in. However, if a person is already registered with CDSL for e-voting, then existing user ID and password can be used for casting vote.
- k. The Board of Directors of the Company has appointed CS Ketan R. Shirwadkar (ACS 37829) or failing him, CS Prakash Nagringrekar (ACS 5941), Designated Partners of HSPN & Associates LLP, Practicing Company Secretary, Mumbai as scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner.
- I. In case of any queries or issues regarding remote e-voting, members may refer 'Frequently asked questions' (FAQs) and 'User manual for shareholders to cast their votes' in help section at www.evotingindia.com All correspondence/queries/grievance related to remote e-voting including obtaining the login id and password by persons who have acquired shares or become Members of the Company after the dispatch of Notice and holding shares as on cut-off date, may be addressed to helpdesk.evoting@cdslindia.com with their name and folio number or contact CDSL e-voting help desk officials 1800225533.
- n. In case the shareholders/members have any queries or issues regarding attending and participating in the AGM and e-voting at the AGM, they can write an email to instameet@linkintime.co.in or call on: - Tel: (022-49186175).
- 4. Registration of email ID and Bank Account details:

In case the shareholder's email ID is already registered with the Company/its Registrar & Share Transfer Agent "RTA"/Depositories, the log in details for e-voting are being sent on the registered email address.

In case the shareholder has not registered his/her/their email address with the Company/its RTA/Depositories and have not updated the Bank Account mandate for receipt of dividend, the following instructions to be followed:

a. In case of Shares held in Physical Mode:

The Shareholder may send a request quoting its Folio No. to RTA by email at rnt.helpdesk@linkintime.co.in

b. In the case of Shares held in Demat mode:

Place : Mumbai

Date : 16/08/2022

The shareholder may please contact the Depository Participant ("DP") and register the email address and bank account details in the demat account as per the process followed and advised by the DP.

By order of Board For, Gujarat Themis Biosyn Limited

-/Sd Rahul D. Soni

Company Secretary & Compliance Officer

addresses are registered with the company/depository participants/shar transfer agent on 12th August, 2022. A copy of the same is available on the company website i.e. www.ceejayfinance.com and on the website of e-voting agency i.e. www.evotingindia.com. Members holding shares in dematerialized mode and whose e-mail address are not registered are requested to register their e-mail addresses with their relevant Depository Participants. Members holding shares in physical mode are requested to demat their holdings/ furnish their e-mail address by writing to the Company with details of folio number alongwith self-attested copy of PAN Card at shaileshbharvad@ceejayfinance.com

3. in compliance with section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015, Reg. 44 of the SEBI Regulations and SS-2 issued by the Institute of Company Secretaries of India, the Company has fixed Friday, 16.09.2022, as the cut-off date' to determine the eligibility to vote by remote e-voting, for participation or e-voting at the AGM. The Company is pleased to provide the members the facility, holding shares as on cut-off date i.e. 16.09.2022 to cast their votes electronically through remote e-voting or through e-voting system on all resolutions set forth in Notice, for which the company has engaged the service of Central Depository Services(India) Ltd as the E-voting Agency. All the members are informed that;

(i) the ordinary and special business as set out in the notice of 29th AGM will be transacted through voting by electronic means;

(ii) the remote e-voting shall commence on Wednesday, 21.09.2022 at 09.00 A.M. (IST) and shall end on Friday, 23.09.2022 at 05.00 p.m. (IST).

(iii) the cut-off date for determining the eligibility to vote through remote e-voting or through electronic system during the AGM is Friday, 16.09.2022;

(iv) any person, who becomes member of the company after sending of the Notice of 29th AGM and holding shares as of the cut-off date i.e. Friday, 16.09.2022, may obtain the login ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com. However, if a person is already registered with CDSL for remote e-voting then existing user id and password can be used for casting vote;

(v) members may note that a) the remote e-voting module shall be disabled by CDSL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the members who have cast their vote by remote e-voting prior to the 29th AGM may participate in the 29th AGM through VC/OAVM facility but shall not be entitled to cast their votes again through e-voting system during the 29th AGM. c) a person whose name is recorded in the register of members or the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting, participating in the 29th AGM through VC/OAVM facility and e-voting during the 29th AGM. d) voting rights of the members shall be in proportion to their shares in the paid up equity share capital of the company as on the cut-off date i.e. Friday, 16.09.2022.

vi) the Notice of 29th AGM and the Annual Report 2021-22 are available on the Company's website and website of the BSE Limited at www.bseindia.com. The notice of the AGM is also available on the website of CDSL at www.evotingindia.com;

vii) The Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Saturday, 17.09.2022 to Saturday, 24.09.2022 (both days inclusive) for the purpose of 29th AGM and for payment of dividend to the shareholders of the Company.

viii) Members holding shares in dematerialized mode and whose e-mail address are not registered are requested to register their e-mail addresses with their relevant Depository Participants. Members holding shares in physical mode are requested to demat their holdings/ furnish their e-mail address by writing to the Company with details of folio number alongwith self-attested copy of PAN Card at shaileshbharvad@ceejayfinance.com

ix). In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQ), for shareholders and e-voting user manuals for shareholders available at the help section of www.evotingindia.com/Help.jsp or call on +91 22 23058783 or +91-22-23058542 during business hours or send a request at helpdesk.evoting@cdslindia.com.

Date : 16th August, 2022

Place: Nadiad

For, Ceejay Finance
Limited
Sd/-
Shailesh Bharvad
Company Secretary

વેસ્ટર્ન ટાઇમ્સ

નાગપુર ટ્રેનિંગ માટે ગચેલા ફાચરના

અમદાવાદ

ભાડુઆતે પચાવી પાડેલો નિરાધાર મહિલાનો બંગલો પોલીસે ખાલી કરાવ્યો

મકાન નિયમ પ્રમાણે ખાલી કરાવી

આપતા વૃધ્ધા ખુશ થઈ ગયા હતા.અને પોલીસ માટે મીઠાઈ લઈ

રાજેન્દ્રભાઈ ગર્ગ છેલ્લા ઘણા

વર્ષોથી શિવરંજની ચારરસ્તા

પાસેની આઝાદ સોસાયટીમાં રહેલા

અમલતાસ એપાર્ટમેન્ટમાં રહે છે.

તેમના પતિ રાજેન્દ્રભાઈ ગર્ગ એક

વર્ષ પહેલાં તેમનું બીજુ મકાન

વસ્ત્રાપુરમાં કાસાવ્યા બંગ્લોઝમાં છે.

એ મકાન મહેશ રેવાભાઈ દેસાઈને

૧૧ મહિના ૨૯ દિવસના કરાર

પ્રમાણે ભાડે આપ્યુ હતુ. પરંતુ તેમના પતિ રાજેન્દ્રભાઈનું કોરોનામાં મૃત્યુ

LIPPI SYSTEMS LTD

Reg.Off: 3rd Floor, Satya Complex,Opp.IOC Petrol Pump, Nr.Ashwamegh IV, 132 ft Ring Road,Satellite,Ahmedabad-380015 Ph.No.079-26750060 / 26750061, Email Id:-cs@lippisystems.com,officelippi@gmail.com web site :-www.lippisystems.com CIN :- L22100GJ1993PLC020382

Unaudited Standalone Financial Results For

The Quarter Ended On June 30, 2022

૬૫ વર્ષીય મહિલા કમલાબેને

આવ્યા હતા

તેમની આંખમાં પણ આંસુ આવી નિપજતાં મહેશ દેસાઈની મકાન ગયા હતા. તેમને વિધવા મહિલાને પ્રત્યે દાનત બગડી હતી.

જેથી મકાન આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમજ તેમના દુબઈમાં રહેતા દિકરાને પણ જાણ કરીને અમદાવાદ આવવા માટે જણાવ્યુ હતુ. પરંતુ તે આવી શકે એમ નહોતુ. જેથી કમલાબેન ગર્ગે રીક્ષામાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્ય હતા, જેથી પીઆઈ એસ.જી.દેસાઈ બહાર જ ઉભા હતા. તેમને તેમની કેબિનમાં બેસાડીને વૃધ્ધાનીી કહાની સાંભળતા જ તેઓ ચોધાર આંસુથી રડી પડ્યા હતા. જેથી વસ્ત્રાપુર પોલીસે તાત્કાલિક અસરથી મૅકાન ખાલી કરાવીને નિરાધાર વૃધ્ધાને અપાવ્યુ હતુ. જેથી વિધવા મહિલા ખુશ થઇ

(Rs. In Lacs

June

30, 2021

(Unaudited)

304.67

10.30

10.30

7.43

0.96

8.39

700.00

0.11

0.11

Year ended

March

31, 2022

(Audited)

1,455.68

119.36

119.36

83.78

(15.62)

68.16

700.00

1.20

1.20

ગયા હતા.

Quarter ended

March

31, 2022

(Audited)

533.77

182.50

182.50

140.91

(7.82)

133.09

700.00

2.01

2.01

By Order Of The Board

Nandlal J.Agrawal

(Managing Director)

(DIN :- 00336556)

June

30,2022

Unaudited)

40.10

(28.15)

(28.15)

(21.05)

(20.76)

700.00

(0.30)

(0.30)

0.28

(એજન્સી) અમદાવાદ,

બા તમે ચિંતાં ન કરો તમે નિરાધાર નથી તમારો દિકરો તમારી સામે જ બેઠો છે. આ શબ્દો છે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જી.દેસાઈના છે. વૃધ્ધાના પતિનું કોરોનામાં મૃત્યુ થયુ હતુ. તેમજ પુત્ર દુબઈ રહેતો હોવાથી નાસીપાસ થઈને દ્રપ વર્ષીય મહિલા કમલાબેન રાજેન્દ્રભાઈ ગર્ગ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચોધાર આંસુએ ૨ડવા લાગ્યા હતા. પીઆઈએ તેમને પૂછ્યુ તો તે ડુસ્કા ભરવા લાગ્યા હતો. અને તેમનો ભાડે આપેલો બંગ્લોઝ એક શખ્સે પચાવી પાડ્યો હોવાનું કહેતા આખી વાત સાંભળીને પીઆઈ ખાંભલા પણ ગદગદ્ થઈગયા હતા અને

Particulars

Total Income From Operations

Profit / (loss) for the period after tax

Other Comprehensive income (OCI)

Profit / (loss) before tax

Rs 10 each)

necessarv.

Place : Ahmedabad

Date : 14/08/2022

NOTES:

(a) Basic EPS (Rs.)

(b) Diluted EPS (Rs.)

Profit /(loss) before exceptional items and tax

(after Execption and/or Extraordinary items)

(after Execption and/or Extraordinary items)

Total Comprehensive Income for the period (7+8)

Paid - up equity share capital (face value of share

8 Earnings per share (EPS) of Rs 10 each (Not annualised):

website of the BSE www.bseindia.com.

No.

ખડીયાને ૭ મહિનાની ટ્રેનિંગ માટે નાગપુર મોકલાયા હતા. આ ત્રણેય સામેવિજીલન્સ તપાસ ચાલી રહી છે. એનએફએસસી કોલેજ જે તે સમયે ખોટી સ્પોન્સરશીપને લઈને પ્રવેશ મેળવનાર ફાયર કર્મચારીઓ વિરૂધ્ધ નાગપુર પોલીસ સ્ટેશનમાં એફઑઈઆર પણ કરી હતી. ફાયર વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુહતુ કે વિજીલન્સ તપાસ ચાલતી હોવાથી અધિકારીઓને કોઈપણ હિસાબે નાગપુરની પ્રતિષ્ઠીત કોલેજમાં ટ્રેન્ટ્રિંગ માટે મોકલો શકાય નહી. મ્યુનિસિપલ કમિશ્નર, મ્યુનિસિપલ બોર્ડ અને ડાયરેક્ટર ફાયર સર્વિસ સમક્ષ અધુરી માહિતી રજુ કરીને ત્રણે અધિકારીંની

પાંચક્રવા એસટીઓ સુધીર ભલામણ કરવામાં આવી હતી.

આંગડિયામાંથી નીકળેલા વેપારી લૂંટાચા

(એજન્સી)અમદાવાદ,

નવરંગ્પુરાના આંગડીયામાંથી પૈસા લઈને નીકળેલા વધુ એક વખત લુંટાયા છે. પીઆરએલ રોડ પર અકસ્માત સર્જીને કમ્પાસ કારને ઘેરી લઈને ૧૦ લાખ રૂપિયા લઈને બાઈકર્સ મીનીટોમાં પંલાયન થયા હતા. યુનિવસીટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

શકો છો, પરંતુ તમારી પાસે પૈસાની વસ્ત્રાપુરમા રહેતા મીત અછત છે તો કચારેય પૈસાની અછત મુકેશકુમાર વાઘેલા ઉ.વ. ૩૦ સ્ટીલ તમારા બાળકના સારા શિક્ષણ વચ્ચે ફેંકટરીએ ધરાવે છે. તા. ૧ ૩ના રોજ નહિ આવે. તમારા બાળકને મફતમાં વાઘેલાએ મિતેશભાઈ સર્વોત્તમ શિક્ષણ આપીશું એ અમારી ગાંધીધામમાં પ્રવીશભાઈ ગેરંટી છે. દિલ્હીમાં કરીને બતાવ્યં છે. રાજપોપટને ત્યાંથી ૧૦ લાખ પંજાબમાં શાળાઓ ઠીક કરવાની સંપૂર્ણ રૂપિયા મગાવ્યા હતા. વી.પટેલ તૈયારીઓ ચાલી રહી છે અને આંગડીયામાંથી ૧૦ લાખ રૂપિયા લઈ પ્લાસ્ટીકની સફેદ થેલીમાં મુકી દિલ્હીની જેમ જ દરેક સરકારી શાળાને ગુજરાતમાં પણ શાનદાર કારમાં ડ્રાઈવર સીટ બાજુમાં સીટ બનાવીશું અને બહુ મોટા સ્તરે સરકારી પર મુકીંને વસ્ત્રાપુરમાં સુંદરવન બંગલોઝ ખાતે પોતાનાં ઘરે જવા માટે નીકળ્યા હતા. મિતભાઈ યનિવસીટી ત્રણ રસ્તાથી પીઆરએલ તરફ જતા વળાંક પર પહોચ્યા હતા. વળાંક લીધો ત્યારે માથે ટોપી પહેરીને મીલેટરી જેવા કપડાં પહેરેલા એક બાઈકરે ડ્રાઈવર સાઈડના કાચને ખખડાવ્યો હતો. કાચ ખોલીને વાત કરતાં મીતભાઈને કહયું હતું કે, ગાડી કઈ રીતે વળાવો છો ? મિતભાઈ કારમાં બેસીને આ શખ્સ સાથે વાત કરતા

હતા તેવા સમયે બાઈકની બીજી બાજીએ બાઈક પર બે શખ્સ આવ્યા હતાં. આ શખ્સોએ ૧૦ લાખ રૂપિયા ભરેલી પ્લાસ્ટીકની થેલી નેજર ચુકવીને ઉઠાવી લીધી હતી.

ઘ ભરાજી સંદાના આગના કારણે ઇલેક્ટ્રીકલ પેનલમાંથી આશરે ૮,૬૦૦ કિ.ગ્રા. સ્ક્રેપ

રસ ધરાવતા ખરીદદારો ઈલેક્ટ્રીક પેનલમાંથી આગથી નુકસાન પામેલ આશરે ૮૬૦૦ કિ.ગ્રા.સ્ક્રેપ આઈટમ માટે ઈ-હરાજીમાં ભાગ લેવા આમંત્રિત કરે છે. જ્યાં છે તે હાલતમાં આપવામાં આવશે. આ સામગ્રી **મેસર્સ પ્રતિભા ફેબ્રિક્સ લિમિટેડ**ની છે. વિષય સામગ્રીનું નિરીક્ષણ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પાંડેસરા, સુરત, ગુજરાત ખાતે ૧૭-૦૮-૨૨ થી ૨૫-૦૮-૨૨ દરમિયાન માત્ર કામકાજના દિવસોમાં સવારે ૧૧ થી સાંજે ૪ વાગ્યા સુધી શ્રી આનંદ સિંહનો ૯૯૨૪૫૨૨૨૬૮ પર સંપર્ક કરી નિરીક્ષણ કરી શકાય છે.

ઈ-હરાજી ૨૬-૦૮-૨૨ના રોજ ૪:૦૦ વાગે ચોજાશે ઈ હરાજીના નિયમો અને શરતો સાથેનું ફોર્મ મેળવવા

માટે કૃપા કરીને શ્રી શમશેર સિંઘ **૨૯૮૫૧૨૨** ૫૨ સંપર્ક કરો અથવા વેબસાઈટ http://sealthedeal.co.in/

પરથી ડાઉનલોડ કરો હરાજી કરનાર સીલ ધ ડીલ જેની રજીસ્ટર ત્રોફીસ દુકાન નં.૧૪૮ પોકેટ સી-૨, સેક્ટર પ રોહિની, દિલ્હી-૧૧૦૦૮પ

ફોર્મ અને ઈએમડી ડીમાન્ડ ડ્રાફ્ટ સાથે સબમિશન કરવાની છેલ્લી


તા. ૨૫-૦૮-૨૦૨૨ ૨:૦૦ વાગ્યા પહેલ

સીજે ફાઈનાન્સ લીમીટેડ

1. Investor can view the unaudited financial results of the company for the quarter

2. Figures of the previous period have been re-grouped /re-arranged wherever

ended 30th June, 2022 on company's website: www.lippisystems.com or on the



૨૯મી વાર્ષિક સાધારણ સભા અને ઈ-વોટિંગની જાણકારી વિષચક

સૂચના

૧. અત્રે સુચના આપવામાં આવે છે કે કંપનીઓ (વ્યવસ્થાપન અને વહીવટ) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૨૦ અંતર્ગત કંપનીના શેર હોલ્ડરોની ર૯મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) શનિવાર, ૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સવારે ૧૧ વાગે મિટિંગની નોટિસમાં સમાવિષ્ટ મુજબ કામકાજ કરવા માટે કોર્પોરેટ બાબતોના મંત્રાલય (એમસીએ) ભારત સરકાર અને સીકયુરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા એપ્રિલ, મે, ૨૦૨૦, જાન્યુઆરી, ૨૦૨૧ અને મે, ૨૦૨૨ માં જારી કરાયેલ સામાન્ય પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦, ૨૦/૨૦૨૦, ૦૨/૨૦૨૧ અને ૦૨/૨૦૨૨ અને અન્ય લાગુ પડતા બધા જ કાયદાઓ અને જારી કરાયેલ સામાન્ય પરિપત્ર અનુસાર વિડિયો કોન્ફરન્સ (વીસી) / અન્ય ઓડિયો વિઝયુઅલ માધ્યમો (ઓએવીએમ) દારા યોજવામાં આવશે.

. ઉકત પરિપંત્રને અનુસાર ૨૯ મી એજીએમની નોટિસ સાથે વાર્ષિક અહેવાલ ૨૦૨૧-૨૨ની ઈલેકટ્રોનિક

૩ અધિકારીને પાછા મોકલી દેવાચા (એજન્સી) અમદાવાદ, અમદાવાદ ફાયર વિભાગે જલાઈમાં ત્રણ સ્ટેશન ફાયર

ઓફિસરને એનઈએસસી (નેશનલ ફાયર સર્વિસ કોલેજ) નાગપુર ખાતે ટ્રેનિંગ માટે મોકલ્યા હતા. આ ત્રણે અધિકારીને કોલેજ પરત મોકલ્યા છે. ત્રણે અધિકારી પ્રોબેશન ઉપર હતા તેમજ તેમની વિરૂધ્ધ વિજીલન્સ તપાસ ચાલતી હોવા છતાં અમદાવાદ ફાયર વિભાગે ડીવીઝનલ ફાયર ઓફિસની ટ્રેનિંગ માટે ત્રણેય અધિકારીની ભલામણ કરી હતી.

ગઢવી, નેરોડા જીઆઈડીસી એસટીઓ સંદિપ પટેલ અને મણીનગર એસટીઓ શુભમ

ગુજરાતના દરેક બાળકને સારું અને મફ્ત શિક્ષણ આપવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ

સિવાય પણ બીજા ઘણા કાર્યો આપવામાં

આવે છે, આ અમે દિલ્હી અને પંજાબમાં

બંધ કરી દીધું છે અને આમ આદમી

પાર્ટીની સરકાર બનતા ગુજરાતમાં પણ

બંધ કરી દઈશું, શિક્ષકોને વિદ્યાર્થીઓને

ભણાવા સિવાય બીજા કોઈ કાર્યો

જયારે ભારતનું દરેક નાગરિક અમીર

બનશે, અને મારું એક જ લક્ષ્ય છે કે હું

ભારતના દરેક ગરીબને અમીર બનાવું.

હું તમને ઉદાહરણ આપવા માંગુ છું કે, દિલ્હીમાં અમે શિક્ષણ મફત કરી દીધું

છે, હમણાં ગુજરાતથી ૩૦-૪૦ પત્રકારો દિલ્હી આવ્યા હતા એ

વિચારીને કે કેજરીવાલ ગુજરાત આવીને શાળાઓ વિશે એટલી મોટી મોટી વાતો

કરે છે તો તેનો ભાંડો ફોડી નાખીયે પરંતુ

તેઓ ૨-૩ દિવસ ત્યાં ફર્યા અને એટલા

ખુશ થઇ ગયા કે મને મળીને કહ્યું કે ભલે

વિંરોધી પક્ષ વાળા ગમે તે કહે પરંતુ તમે

શિક્ષા અને સ્વાસ્થ્યમાં સરાહનીય કામ

સરકારી શાળામાં અભ્યાસ કરે છે, અને

સમગ્ર ભારતમાં ૧૭ કરોડ બાળકો

ભારત ત્યારે જ અમીર બનશે

આપવામાં આવશે નહિ.

અમદાવાદ.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલજી બપોરે ૨ વાગે ભુજ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટે પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા અરવિંદ કેજરીવાલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય

કન્વીનર અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ ભુંજમાં ટાઉન હોલ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, જ્યારે અહીંયા આવવાની વાત ચાલતી હતી ત્યારે બધાએ પૂછ્યું કે આજે તો તમારો જન્મદિવસ છે તો તમે કઈ રીતે આવશો? મેં કહ્યું કે દિલ્હીમાં તો દરેક વર્ષે જન્મદિવસ માનવીએ છીએ આ વખતે ગુજરાતમાં માનવીએ અને અહીંયા આવ્યા બાદ જનતા તરફથી જે પ્રેમ અને સહકાર મળ્યો છે તેનો હું ખુબ જ આભારી છું. મને પૂછવામાં આવ્યું કે દિલ્હી તો રાજધાની છે ત્યાં શાળાઓ બનાવું સહેલું છે પણ તમે ગુજરાતમાં કઈ રીતે બનાવશો? મારે તેમને કહેવું છે કે દિલ્હીમાં પણ પહેલા ગુજરાત જેવી જ હાલત હતી, ભાજપ અને કોંગ્રેસ વાળાઓએ ૭૦ વર્ષમાં દિલ્હીમાં પણ કોઈ કામ કર્યું નથી. તે બધી જ શાળાઓ અમે આવીને ઠીક કરી છે કેમકે અમને કરતા આવડે છે. જો અમે દિલ્હીમાં કરી બતાવ્યું તો

ગુજરાતમાં પણ કરી બતાવીશું. એક યુવાને કહ્યું કે, તે પોતે ફક્ત ર ર વર્ષનો છે તેની કામ કરવાની ઉમર નથી પરંતુ ભણવાની ઉમર છે. પણ ભાજપના રાજમાં એને કામ કરવું પડી રહ્યું છે. અમારું પણ એ જ કહેવું છે કે જો ભાજપ અને કોંગ્રેસે ૭૦-૭૫ વર્ષ કંઈ કામ કર્યું હોટ તો ક્વારેય આમ આદમી પાર્ટી બનાવવાની જરૂર જ ના પડત, ભાજપ કોંગ્રેસે કંઈ કામ કર્યું નથી એટલે હવે જનતાએ તેમની પોંતાની આમ આદમી પાર્ટી બનાવવાની ફરજ પડી છે. ગુજરાતમાં શિક્ષકોને ભણાવા

શ્રેણી ક્રિચેટ એન્ડ પ્લેની શક્તિથી સમૃદ્ધ છે

અમદાવાદ, લેનોવો દ્વારા તેની ભાવિ પેઢીની જ્વેલ- ક્રાફ્ટેડ યોગા સિરીઝ, ધ બેટલ-રેડી લીજન આઈડિયાપેડ ગેમિંગ લેપટોપ્સ ભારતમાં રજૂ કરીને ગ્રાહકોને તેમની રીતે વધુ કરવા માટે સશક્ત બનાવ્યા છે. લાઈનઅપમાં લીજન પૈ, લીજન પૈ પ્રો. લીજન સ્લિમ 7i અને યોગા 9i, યોગા સ્લિમ 7i Pro અને યોગા ૭ે સાથે આઈડિયાપેડ ગેમિંગ 3ાંનો સમાવેશ થાય છે. બધાં લેપટોપ્સ ૧૨મી પેઢીના ઈન્ટેલ કોિરન પ્રોસેસર, ઝડપી ગ્રાફિક્સ, સુધારિત બેટરી કામગીરી અને સક્ષમ ડિંઝાઈનથી સમૃદ્ધ હોવાથી ગ્રાહકો માટે લેનોવોના સ્માર્ટર ઈનોવેશનને નવી ઊંચાઈએ લઈ જાય છે.

કળાકારીગરી અને સ્માર્ટ Al-પાવર્ડ યોગા લેપટોપ્સ યુઝર ઈન્ટએકશન ધારવા અને સ્માર્ટર, ઉંચ્ચ કામગીરીની ગમિંગ અને કન્ટેન્ટ નિર્મિતીની સીમાઓ પાર કરવા માટે તૈયાર કરવામાં આવ્યાં છે. આ અત્યંત સ્લિમ અને ઓએલઈડી ડિસ્પ્લે સાથે હલકાં લેપટોપ્સ છે અને આસાન અને વધુ આરામદાયક મોબિલિટી અને હેન્ડલિંગ માટે સોફ્ટ કોન્ટુર્સને હ્યુમનાઈઝ કરવા સાથે સહજ ધારદાર ડિઝાઈનને જોડે છે. નવા લીજન અને આઈડિયાપેડ ગેમિંગ લેપટોપ્સ કામગીરીમાં ટોચના ઈનોવેશન અને રોમાંચક ગેમિંગ અનુભવ લાવે છે. મિનિમલ ડિઝાઈન લેન્ગ્વેજ સહજ ગેમપ્લે અનુભવ પ્રદાન કરવા માટે અસરકારક શર્મલ

ચોગા અને લીજન લેપટોપ્સની લેનોવોની નવી

કર્યું છે.

શાળાઓ ખોલવામાં આવશે. હમણાં તે ૧૭ કરોડ બાળકોનું ભવિષ્ય ઘણા લોકોએ કહ્યું કે કચ્છમાં શાળાઓ અંધકારમાં છે. જો દિલ્હીમાં સરકારી નથી, પરંતુ અમે ખૂબ જ મોટા સ્તરે સરકારી શાળાઓ બનાવીશું અને શાળામાં ભણતા ૧૮ લાખ બાળકોનું ભવિષ્ય ઉજ્લ્વળ કરી શકીએ છીએ તો હાલની સરકારી શાળાઓને શાનદાર બનાવીશું. દિલ્હીની સરકારી શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રકચર, ક્લાસરૂમ, દેશમાં પણ ૧૭ કરોડ બાળકોનું ભવિષ્ય ઉજ્લ્વળ કરી શકીએ છીએ અને ગુજરાતમાં પણ પ૩ લાખ બાળકોનું બ્લેકબોર્ડ, ડેસ્ક એટલા સારા થઇ ગયા છે કે હવે કોઈ ખાનગી શાળાઓમાં જવા

ભવિષ્ય ઉજ્લ્વળ કરી શકાય છે. જો

ગુજરાતમાં પણ સરકારી શાળાઓ

સુધારવામાં આવે તો થોડા જ વર્ષોમાં

ગુજરાતનું ભવિષ્ય બદલી શકાય છે

અને આવી રીતે જ ગુજરાત આગળ

વધશે, ભારત દેશ આગળ વધશે. બાકી

બીજા લોકો તો ફક્ત મોટી મોટી વાતો

અને મફત શિક્ષણ આપવામાં આવશે.

જો તમારી પાસે પૈસા હોય અને તમે

ખાનગી શાળામાં જ પોતાના બાળકને

ભણાવા માંગતા હોય તો તમે ભણાવી

ગુજરાતમાં પણ કરી બતાવીશું.

ગુજરાતના દરેક બાળકને સારું

કરે છે, કરતા કંઈ નથી.

નથી માંગતું. ગુજરાતમાં પણ એવું જ કરશું ખાનગી શાળાઓ કૂરતા સરકારી શાળાઓ શાનદાર બનાવીશું.



applicable provisions of the Companies Act, 2013 and rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with General Circulars No. 14/2020 dated April 08, 2020; No.17/2020 dated April 13, 2020 and No.20/2020 dated May 5, 2020;No. 02/2021 dated January 13, 2021, 21/2021 dated December 14, 2021 and 2/2022 dated May 5, 2022 and other applicable circulars issued by the Ministry of Corporate Affairs("MCA") and circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020, 79 dated May 12, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 of SEBI (collectively referred to as "applicable circulars"), to transact the business set out in the Notice convening

નવાં સક્ષમ, જ્વેલ- ટોન્ડ મેનેજમેન્ટને પહોંચી વળે છે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર હકમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી



પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર ૭૬માં સ્વતંત્રતા દિવસની ખબ જ ધામધમથી ઉજવણી કરેવામાં આવી. અમદાવાદ મંડળ કાર્યાલય પરિસરમાં આયોજિત એક ગૌરવપૂર્ણ સમારોહમાં મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને આરપીએફ તથા સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સની સંયુક્ત પરેડનું નિરીક્ષણ કર્યા બાદ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સલામી લીધી હતી. આ પ્રસંગે તેમણે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક પ્રકાશ બુટાનીનો સ્વતંત્રતા દિવસનો સંદેશ વાંચ્યો હતો. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક તરૂણ જૈને વિવિધ વિભાગોના ૪૫ રેલ્વે કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ રોકડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, અમદાવાદના અધ્યક્ષા મતી ગીતિકા જૈને કેન્સરથી પીડિત ૦૫ રેલવે કર્મચારીઓને આર્થિક સહાય આપીને મદદ કરી. આ દરમિયાન આઝાદીના પ્રતીકરૂપે ત્રિરંગાના કલરના ફુગ્ગા પણ હવામાં છોડવામાં આવ્યા હતા. અમદાવાદ મંડળની સાંસ્ક્રતિક ટીમ દ્વારા દેશભક્તિ આધારિત નૃત્ય અને ગીતો રજૂ કરવામાં

ਪੇસ્ટન ટાઇટ્સ **વેસ્ટર્ન ટાઇમ્સ**માં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

-જાહેરખબર મેનેજર

the AGM. Members will be able to attend and vote at the AGM through VC/OAVM. Members participating through the VC/OAVM facility only shall be deemed to be present at the AGM and their presence shall be reckoned for the purpose of quorum.

- In compliance with the applicable circulars, the Notice convening the AGM and the standalone financial statements for the financial year 2021-22, along with Board's Report, Auditors' Report and other documents required to be attached thereto, have been sent to all the Members of the Company only via electronic mode on **Tuesday**, **16th August**, **2022** whose email addresses are registered with Company/ Depository Participants(s). The aforesaid documents will also be available on the Company's website at www.gtbl.in and on the website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com.
- 3. Instructions for remote e-voting and e-voting during AGM
- The Company is providing to its members facility to exercise their right to vote on resolutions proposed to be passed at AGM by electronic means ("e-voting"). Members may cast their votes remotely, using the electronic voting system of CDSL during the period mentioned herein below ("remote e-voting").
- Further, the facility for voting through electronic voting system will also be made available at the AGM and members attending who have not cast their vote(s) by remote e-voting will be able to vote at the AGM through e-voting. The members who have cast their vote(s) by remote e-voting may also attend the AGM but
- shall not be entitled to cast their vote(s) again at the AGM.
- The Company has engaged the services of Central Depository Services (India) Limited (CDSL) an agency to provide ("remote e-voting").
- The Company has engaged the services of Company's RTA Link Intime India Private Limited e. as the Agency to provide for participation in the 41st AGM through VC/OAVM Facility (Instameet) and e-Voting during the 41st AGM.
- Information and instructions including details of user id and password relating to e-voting have been sent to members through e-mail.
- Members are requested to carefully read the instructions mentioned in the notes forming part of Notice of the 41st AGM for remote e-voting and for attending AGM and e- voting at AGM

The remote e-voting facility will be available during the following period: Date and time of Commencement of remote e-voting Sunday, August 4, 2022 at 9:00 am Date and time of end of remote e-voting. Tuesday, August 6, 2022 at 5:00 pm

- The remote e-voting module shall be disabled by CDSL for voting thereafter. Once the vote or resolution is cast by shareholder, the shareholder shall not be allowed to change it subsequently Shareholders' of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date **Tuesday, August 30, 2022** may cast their vote electronically. Any person, who acquires shares of the Company and becomes a member of the Company after dispatch of the Notice and holding shares as on the cut-off date i.e. Tuesday, 30th August
- 2022, may obtain the login ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.comor rnt.helpdesk@linkintime.co.in. However, if a person is already registered with CDSL for e-voting, then existing user ID and password can be used for casting vote.
- The Board of Directors of the Company has appointed CS Ketan R. Shirwadkar (ACS 37829) or failing him, CS Prakash Nagringrekar (ACS 5941), Designated Partners of HSPN & Associates LLP, Practicing Company Secretary, Mumbai as scrutinizer to scrutinize the e-voting process in a fair and transparent manner.

In case of any queries or issues regarding remote e-voting, members may refer 'Frequently asked questions' (FAQs) and 'User manual for shareholders to cast their votes' in help section at www.evotingindia.com All correspondence/queries/grievance related to remote e-voting including obtaining the login id and password by persons who have acquired shares or become Members of the Company after the dispatch of Notice and holding shares as on cut-off date, may be addressed to **helpdesk.evoting@cdslindia.com** with their name and folio number or contact CDSL e-voting help desk officials 1800225533.

- In case the shareholders/members have any queries or issues regarding attending and participating in the AGM and e-voting at the AGM, they can write an email to instameet@linkintime.co.in or call on: - Tel: (022-49186175).
- **Registration of email ID and Bank Account details:**

In case the shareholder's email ID is already registered with the Company/its Registrar & Share Transfer Agent "RTA"/Depositories, the log in details for e-voting are being sent on the registered email address.

In case the shareholder has not registered his/her/their email address with the Company/its RTA/Depositories and have not updated the Bank Account mandate for receipt of dividend, the following instructions to be followed:

In case of Shares held in Physical Mode:

The Shareholder may send a request quoting its Folio No. to RTA by email at rnt.helpdesk@linkintime.co.in

In the case of Shares held in Demat mode:

Place : Mumbai

Date : 16/08/2022

The shareholder may please contact the Depository Participant ("DP") and register the email address and bank account details in the demat account as per the process followed and advised by the DP.

> By order of Board For, Gujarat Themis Biosyn Limited Sd/-

Rahul D. Soni **Company Secretary & Compliance Officer** કોપીઓ શેર હોલ્ડરોને ઈલેકટ્રોનીક માધ્યમથી (ઈમેઈલ) મોકલવામાં આવી છે, જેમના ઈ-મેઈલ સરનામા કંપની/ડિપોઝિટરી સહભાગો(ઓ) પાસે ૧૨મી ઓગસ્ટ, ૨૦૨૨ ના નોંધાયેલા છે. તેની નકલ કંપનીની વેબસાઈટ, એટલે કે, www.ceejayfinance.com પર અને ઈ-વોટિંગ એજન્સીની વેબસાઈટ, એટલે કે www.evotingindia.com પર ઉપલબ્ધ છે. ડીમટીરીયલરાઈઝ માધ્યમમાં શેર ધરાવતા સભ્યો અને જેમના ઈમેઈલ સરનામાની નોંધણી થયેલ નથી, તેમને તેમના ઈમેઈલ સરનામા તેમના ડીપોઝીટરી સહભાગીયો/ શેર ટ્રાન્સફર એજન્ટ સાથે નોંધણી કરવા વિનંતી છે. પ્રત્યક્ષ માધ્યમમાં શેર ધરાવતા સભ્યોનો તેમના હોલ્ડીંગ્સ ડીંમેટ કરવા/ફોલીયો નંબરની વિગતો તથા પેનકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ સાથે કંપનીને shaileshbharvad@ceejayfinance.com ઉપર લખીને તેમના ઈ-મેઈલ સરનામાની નોંધણી કરાવવા વિનંતી છે.

૩. કંપની ધારા ૨૦૧૩ની કલમ ૧૦૮ની જોગવાઈઓ તથા સુધારા સહિતના કંપનીઝ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમો ૨૦૧૪ના પેટા નિયમ ૨૦, સીક્યુરીટીઝ અને એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના (લિસ્ટિંગ ઓબ્લિંગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રીકવાયરમેન્ટ્સ) નિયમો, ૨૦૧૫ના નિયમન ૪૪ અન્વયે તેમજ ધ ઈન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડીયાના સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ-ર મુજબનુ પાલન કરીને, કંપનીએ શુક્રવાર, તા. ૧૬ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના કટ-ઓફ રોજ શેર્સધારણ કરે તો તેવા શેર ધરાવતા સભાસદને ૨૯ મી એજીએમ અને ઈ-મતદાન દુબારા મત આપવાની યોગ્યતા નક્કી કરેલ છે. કંપનીએ તેમના સભ્યોના શેર ડીમેટ અથવા ફીઝીકલ મોડમાં ધરાવતા હોય તેવા સભ્યોને સામાન્ય અને વિશેષ વ્યવસાયો પર ઈ-વોટિંગ દ્વારા પોતાનો મત આપવા માટે કટ-ઓફની તારીખ શુક્રવાર,૧૬ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ નિર્ધારીત કરવામાં આવી છે. જે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીઝ (ઈન્ડીયા) લિમિટેડ દ્વારા રિમોટ ઈ-વોટિંગ માટેની પ્રક્રિયામાં જણાવાયુ છે.

ક. ૨૯ મી એજીએમની સૂચનામાં જણાવેલ સામાન્ય અને વિશેષ વ્યવસાયોનો મતદાન ઈલેકટ્રોનિક માધ્યમથી કરવામાં આવશે.

ખ. રિમોટ ઈ-વોટિંગનો પ્રારંભ બુધવાર, તા.૨૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના સવારે ૯.૦૦ કલાકે (ભારતીય સમયાનુસાર) શરૂ થશે અને શુક્રવાર, તા.ર૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના સાંજના ૫.૦૦ કલાકે (ભારતીય સમયાનુસાર) તેનું સમાપન થશે.

ગ. ૨૯ મી એજીએમ દરમિયાન રિમોટ ઈ-વોટિંગ દ્વારા ઈ-મતદાન કરવાની યોગ્યતા નક્કી કરવા માટેની કટ-ઓફની તારીખ શુક્રવાર, ૧૬મી સપ્ટેમ્બર, ૨૦૨૨ છે.

ઘ. કોઈપણ વ્યકિત કે જે કંપનીના શેર્સ હસ્તગત કરે અને નોટિસ મોકલ્યાની તારીખ પછી કંપનીના સભ્ય અને કટ-ઓફની તારીખ શુક્રવાર, ૧૬ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ શેર્સ ધારણ કરે તો તેવા સભ્યોએ રિમોટ ઈ-વોટિંગ કરવા માટે helpdeskevoting@cdslindia.com પર યુઝર આઈડી અને સીકવન્સ નંબર માટેની વિનંતી કરીને મેળવી શકે છે. જોકે, જે તે વ્યકિતની રિમોટ ઈ-વોટિંગ માટે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીઝ (ઈન્ડીયા) લિમિટેડમાં નોંધણી થઈ ગયેલ હોય તો તેનો મત આપવા માટે તેઓ તેમના હાલના યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકે છે.

ચેં. સભાસદો નોંધ લે કે : ૧) રિમોટ ઈ-વોટિંગ માટેની પ્રક્રિયા સીડીએસએલ દ્વારા મતદાન માટે ઉપરોકત તારીખ અને સમય પછી ઈ-વોટિંગ કરવા દેવામાં આવશે નહીં અને સભ્યો દ્વારા ઠરાવ મત આપવામાં આવે તે પછી સભ્યને બદલવાની મંજૂરી આપશે નહીં. ૨) જે સભ્યોએ ૨૯ મી એજીએમ પહેલા રિમોટ ઈ-વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો છે તે[ઁ]વીસી / ઓએવીએમ સુવિધા દ્વારા ૨૯ મી એજીએમમાં ભાગ લઈ શકે છે, પરંતુ ૨૯મી એજીએમ દરમ્યાન ફરીથી ઈ-વોટિંગ સિંસ્ટમ દ્વારા પોતાનો મત આપવાનો હક્કદાર રહેશે નહીં. ૩) ૨૯મી એજીએમમાં ભાગ લેનારા સભ્યો અને જેમુણે રિમોટ ઈ-વોટિંગ દ્વારા પોતાનો મત આપ્યો ન હોય, તેઓ ૨૯મી એજીએમ દરમ્યાન ઈ-વોટિંગ દ્વારા પોતાનો મત આપવા માટે હક્કદાર રહેશે. ૪) જે સભ્યો કટ-ઓફ તારીખ સુધી ડિપોઝિટરીઝ દારા જાળવવામાં આવતા સભ્યોનાં પત્રક અને લાભકર્તા માલિકોનાં સાસ્યા કેટ આર તારાબ લુવા ાડવાડાટરાઝાકારા જાળવવાના આવતા સાસ્યાળા વગ્રેક અને લાસ્મકાતા માલકાળા પત્રકમાં જે વ્યક્તિનું નામ નોંધાયેલ હશે ફકત તેઓ જ વીસી / ઓએવીએમ અથવા રિમોટ ઈ-વોટિંગ સુવિધા મેળવવા માટે હક્કદાર રહેશે. ૫) જે સભ્યોનો મત અધિકાર કંપનીની પેઈડ અપ ઈકિવટી શેર મૂડીમાં કટ-ઓફની તારીખ શુક્રવાર, ૧૬ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના શેરના પ્રમાણમાં રહેશે. છ. ૨૯મી એજીએમની સૂચના અને વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઈટ www.ceejayfinance.com

પર અને બીએસઈ લિમિટેંડ www.bseindia.com ઉપર પણ ઉપલબ્ધ છે. ૨૯ મીં એજીએમની સૂચના સીડીએસએલની વેબસાઈટ www.evotingindia.com ઉપર પણ ઉપલબ્ધ છે.

જ. કંપનીના સભ્યોનુ પત્રક અને શેર ટ્રાન્સફરનાં ચોપડા શનિવાર તા. ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૨ થી શનિવાર તા.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૨ (બન્ને દિવસો સમાવિષ્ટ) સુધી કંપનીની સામાન્ય સભા તેમજ કંપનીના પૂરા થયેલા વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે બંધ રહેશે.

ઝ. જે કોઈ સભાસદોને ઈ-વોટિંગ માટેનાં પ્રશ્નો / ફરિયાદ હોય તો તેઓ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીઝ (ઈન્ડીયા) લિમિટેડની વેબસાઈટ : www.evotingindia.com ઉપર ફ્રીકવન્ટલી આસ્કડ કવેશ્વન્સ (એફ.એ.કયુ.) અને ઈ-વોટિંગ યુઝર મેન્યુઅલ ઉપલબ્ધ છે, તેને રીફર કરી શકે છે અથવા helpdesk.evoting@cdslindia.com પર ઈમેલ કરી શકે છે અથવા ફોન નં.૦૨૨-૨૩૦૫૮૫૪૨ અથવા ૦૨૨-૨૩૦૫૮૭૩૮ ઉપર સંપર્ક કરી શકે છે.

તારીખઃ ૧ક્મી ઓગસ્ટ, ૨૦૨૨ સ્થળઃ નડિયાદ	સીજે ફાઈનાન્સ લીમીટેડ વતી સહી/- શેલેષ ભરવાડ કંપની સેક્રેટરી
--	--

<u>ઓપન 'ઈ' ટેન્ડર નોટીસ</u>

ટેન્ડર બંધ થવાનો સમય એ જ તારીખે. 15.00 કલોકે વેબ પેજ વિગતો અને નોટીસ બોર્ડનું સ્થળ જ્યાંથી સંપૂર્ણ વિગતો જોઈ શકાશે અને ઓફિસ અને સપષ્ટતાનું **સરનામુ** : વેબસાઈટ @ <u>www.ireps.gov.in</u> ડિવિઝનલ રેલવે મેનેજર (ઈલેક્ટ્રિકલ ટીઆરડી), પશ્ચિમ રેલવે, પ્રતાપનગર, વડોદરા-390004. (EL/TRD/ Tender/22-23/01 dtd. 12.08.2022) 103 અમને લાશક કરોઃ <table-cell-rows> facebook.com/Wes

<u>પીએસઆઈના નિભાવનું આઉટસોર્સિંગ</u> રન્ડર નં.: EL/TRD/Tender/22-23/01 ભારતના રાષ્ટ્રપતિ વતી અને માટે ડિવિઝનલ રેલવે મેનેજર (ઈલેક્ટ્રિકલ ટીઆર.ડી) પશ્ચિમ રેલવે,

દેશભક્તિની ભાવનાથી રોમાંચિત

કરી દીધા હતા. અને આ કાર્યક્રમ

બાદ તમામ અધિકારીઓએ

વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે

મહિલા કલ્યાણ સંગઠનના સભ્યો,

અપર મંડળ રેલ પ્રબંધક અનંત

કુમાર, અપર મંડળ રેલ પ્રબંધક

(ઇન્ફા) દયાનંદ સાહૂ, વરિષ્ઠ મંડળ

સુરક્ષા કમિશનર ઇબ્રાહિમ શરીફ

તથા અન્ય અધિકારીઓ અને રેલ્વે

કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા

હતા. અમદાવાદ, સાબરમતી,

પાલનપુર, મહેસાણા, ગાંધીધામ

સહિત મંડળના તમામ સ્ટેશનો,

કારખાનાઓ અને ડેપો પર સ્વાતંત્ર્ય

પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં

પશ્ચિમ રેલવે-વડોદરા ડિવિઝન

આવી હતી.

તાપનગર, વડોદેરા-39004 દ્વારા નીચેના કામો માટે ન્ડર્સ આમંત્રિત કરવામાં આવે છે. **ક્રમ. સં. 1 ટેન્ડર**

ન્સ્ટોલેશન) સંપત્તિઓના અને અન્ય ઓક્સિલર વૃત્તિઓના નિભાવના આઉટસોર્સિંગનું કામ. **કામર્ન** બંદાજીત પડતર (₹ માં): 3.30.72.090/- અર્નેસ્ટ મની ડિપોઝીટ (₹ માં): 3,15,400/- ટેન્ડર કસ્તાવેજની પડતર અને પૂર્ણતાનો સમયગાળો વિના મૂલ્યે. પૂર્ણતાનો સમયગોળો 24 **મહિના ટેન્ડર શેડ્યૂલ :** ટેન્ડર બંધ થવાની તારીખ 12.09.2022 અને

નં. અને કામનું નામઃ EL/TRD/Tender/22-23/01 વડોદરા ડિવિઝનના સુરત-ગેરતપુર, વડોદરા-ગોધરા, ગોધરા-અણારંદ અને આણંદ-ખંભાત સેક્શન્સમાં પીએસઆઈ (પાવર સપ્લાય